

ફોર્મ નં. ૨ દરેક મૃત્યુ નોંધ માટે ભરવું ફરજિયાત છે.

મરણ રિપોર્ટ  
કાયદાકીય માહિતી  
આ ભાગ મરણ રજિસ્ટર સાથે જોડવો.

માહિતી આપનારે ભરવું

૧. મરણની તારીખ :

૨-ક. મરનારનું પુરુષ નામ :

૨-મ. મરનારના પિતા/પતિનું નામ :

૨-ગ. મરનારના માતાનું નામ :

૩. મરનારની જાતિ (✓ કરો) : પુરુષ  સ્ત્રી  અન્ય

૪. મરનારની ઉંમર :

(૧ વર્ષથી વધુ હોય તો પૂરા વર્ષમાં, ૧ વર્ષથી ઓછી હોય તો પૂરા મહિનામાં, ૧ મહિનાથી ઓછી હોય તો પૂરા દિવસોમાં અને જો ૧ દિવસથી ઓછી હોય તો પૂરા કલાકમાં લખો).

૫-અ. મરનારનું કાયમી રહેઠાણનું સરનામું :

૫-બ. મૃત્યુ સમયે મરનારનું સરનામું :

૬. મરણનું સ્થળ (✓ કરો) : ૧. દવાખાનું/સંસ્થા  હોય તો નામ \_\_\_\_\_  
સરનામું \_\_\_\_\_

૨. ઘર  ૩. અન્ય સ્થળ

૭. માહિતી આપનારનું નામ \_\_\_\_\_

સરનામું :

તારીખ :

માહિતી આપનારની સહી અથવા  
ડાબા અંગૂધાનું નિશાન.

(કોલમ ૧ થી ૧૮ બધા જ પૂર્ણ બર્યા બાદ, માહિતી આપનારે અહીં તારીખ બાબી સહી કરવો.)

રજિસ્ટ્રારે ભરવું

નોંધણી નંબર

નોંધણી તારીખ

જિલ્લો

શહેર / ગામનું નામ :

રિમાર્ક્સ (જો હોય તો) રજિસ્ટ્રારનું નામ અને સહી

દરેક મૃત્યુ નોંધ માટે ભરવું ફરજિયાત છે.

મરણ રિપોર્ટ

આંકડાકીય માહિતી

આ ભાગ કાપીને ફોર્મ નં. ૧૨ માં માસિક સમરી રીપોર્ટ સાથે તાલુકા રજિસ્ટ્રારને મોકલવો.

ફોર્મ નં. ૨

માહિતી આપનારે ભરવું

૮. મરનારનું રહેઠાણ :

(અ) રાજ્યનું નામ : ગુજરાત

(બ) જિલ્લાનું નામ :

(ક) તાલુકાનું નામ :

(દ) શહેર / ગામનું નામ :

(૧૧) ટીક કરો (✓) શહેર  ગામ

૯. ધર્મ (✓ કરો) : હિન્દુ  મુસ્લિમ  પ્રિસ્તી

અન્ય  (ધર્મનું નામ લખવું)

૧૦. મરનારનો ધર્મો :

૧૧. મરણ પહેલાં કોઈ તબીબી સારવાર મળી હોય તો તેનો પ્રકાર (✓ કરો) :

૧. સંસ્થાકીય.

૨. અન્ય-સંસ્થાકીય સિવાયની.

૩. તબીબી સારવાર મળી નથી.

માહિતી આપનારે ભરવું

૧૨. મરણનું કારણ તબીબી રીતે પ્રમાણિત થયેલું છે ? (✓ કરો)

૧. હા  ૨. ના

૧૩. રોગનું નામ અથવા મરણનું ખરેખર કારણ :-

૧૪. જો સ્ત્રી મરણ હોય તો સદરહુ મરણ સગર્ભવસ્થામાં પ્રસૂતિ દરમાન અથવા પ્રસૂતિ બાદ ઇ અઠવાતિયામાં થયેલ છે ? (✓ કરો)

૧. હા  ૨. ના

૧૪-અ ક્રમ-૧૪ ની વિગત લા હોય તો મૃતકનું શિકણા સ્તર : (✓ કરો)

અભાગ  ધો. ઉથી ઓછું

ધો. ઉથી વધુ અને ધો. ૧૨થી ઓછું  ધો. ૧૨થી વધુ

પણ ગ્રેજ્યુએટથી ઓછું  ગ્રેજ્યુએટ અને વધુ

નહીં દર્શાવેલ

૧૫. મૃતકને ધૂપ્રાપાન કરવાની ટેવ હોય તો કેટલા વર્ષથી ? :

૧૬. જો કોઈ પણ રીતે તમાકુ ચાવવાની ટેવ હોય તો કેટલા વર્ષથી ?

૧૭. સોપારી ખાવાની ટેવ હોય તો (પાન મસાલા સહિત) કેટલા વર્ષથી ? :

૧૮. દારુ પીવાની ટેવ હોય તો કેટલા વર્ષથી ? :

(માહિતી ભરવાના કોલમ પૂર્ણ થયા બાદ માહિતી આપનારે ડાબી બાજુ સહી કરવી)

રજિસ્ટ્રારે ભરવું

નોંધણી નંબર :

નોંધણી તારીખ :

મરણ તારીખ :

જાતિ : (પુરુષ/સ્ત્રી/અન્ય જે હોય તે સ્પષ્ટ લખવું)

ઉંમર : વર્ષ/માસ/દિવસો/કલાકો (સ્પષ્ટ ઉંમર લખવી) :

મરણનું સ્થળ : - ૧. દવાખાનું / સંસ્થા ૨. ઘર ૩. અન્ય સ્થળ

રજિસ્ટ્રારનું નામ અને સહી :

માહિતી આપનારે ભરવાના કોલમ પૂર્ણ થયા બાદ માહિતી આપનારે ડાબી બાજુ સહી કરવી